

Date: December 09, 2025

To

BSE Limited The National Stock Exchange of India Limited

P J Towers, "Exchange Plaza",

Dalal Street, Bandra – Kurla Complex,

Mumbai – 400 001 Bandra (E), Mumbai – 400 051

Scrip Code: 541450 Scrip Code: ADANIGREEN

Dear Sir,

Sub: Newspaper Advertisement - Notice of Extraordinary General Meeting through Video Conferencing / Other Audio Visual Means ("VC / OAVM") facility and Remote E-voting information

Please find attached herewith copies of newspaper advertisements published in the Indian Express (English) and Financial Express (Gujarati) on December 09, 2025, both newspapers having electronic editions, intimating that the Extra Ordinary General Meeting ("EGM") of the Company will be held on Friday, January 02, 2026 at 11.00 a.m. through VC / OAVM facility and information regarding remote e-Voting for the EGM of the Company in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

You are requested to take the same on your records.

Thanking You

Yours Faithfully,

For, Adani Green Energy Limited

Pragnesh Darji Company Secretary

Adani Green Energy Limited Adani Corporate House, Shantigram, Nr Vaishno Devi Circle, S G Highway Khodiyar, Ahmedabad 382 421 Gujarat, India CIN: L40106GJ2015PLC082007 Tel +91 79 2555 5555 Fax +91 79 2555 5500 investor.agel@adani.com www.adanigreenenergy.com RO CONCESSIONS AT CSMI AIR

Mumbai International Airport Limited ("MIAL") invites parties to participat in the competitive bidding process for Passenger Services Concession at Chhatrapati Shivaji Maharaj International Airport ("CSMIA"), Mumba Parties are requested to visit the website:

mia.adaniairports.com/ → Business → Tenders) to do ation form for purchase of RFP documents

Please check the website for the deadline for submission of Applicat

Narmada Water Resources, Water Supply & Kalpasar Dept.

DNLINE SHORT TENDER NOTICE NO. 28 of 2025-26

Executive Engineer, Desa Intigation Division Desses, Damindada canal colony opp. Dipak Holel, Desses 385535 (Phono No. 02744-220071) Invited contine tenders for Avorks for which estimated costs are Rs. 0.72 to 84.06 lakh form the Appropriare Category Class of contractor Registered with NVRWIS & Kalpasse Dept. OR RSB Department of Gujatat.

1. Period for download & submission of ornite tenders. do. 109/12/2025 to dt.

24/12/2025 up to 18.00 hrs.
2. Physical submission of Tender Fee & EMD : Within next 7 working day

2. Physical submission of lender Fee & EMD. Within next 7 working days after last date of online Tender Submission (By FRAD to Speed Post only) 3. Opening of Tender St. No. 3 to 4: tl. 24/12/2025 at 18.05 Hrs. 4. Opening of Tender St. No. 10 to 2: tl. 24/12/2025 at 18.05 Hrs. 5. Opening of Tender St. No. 10 to 2: tl. 26/12/2025 at 18.05 Hrs. 5. Opening of Tender St. No. 10 to 2: tl. 26/12/2025 at 11.00 Hrs. Details Tender Notice will be available on <a href="https://doi.org/10.1001/j.news.no.1001 will be published on <u>www.tender.nprocure.com</u> only and it will be bindin to all the contractors.

CHANGE OF NAME

SANKALIYA RAJE MATHURBHAI

CHANGED MY NAME FRO SANKALIYA RAJESHKUMAR MATHURBHAI TO SANKALIYA RAJES MATHURBHAI AND FROM NOW ONWARDS

SHALL BE KNOWN BY NEV NAME AS SANKALIYA RAJESH MATHURBHA

SANKALIYA RAJESH MATHURBHA

Classifieds

PERSONAL

Change Of Name I have changed my name from ZARINABEN AAIYUBBHAI MANSURI

to JARINABANU AAIYUBBHAI MANSURI D/502. Royal Akbar

Maktampur. Ahmedabad-380055

CHANGE OF NAME HITEN DHIRAJLAI

THOSANI DECLARE THAT I HAVE CHANGED MY NAME FROM HITENKUMAR DHIRAJLAL
THOSANI TO HITEN
DHIRAJLAL THOSAN E AS HITEN DHIRAJLAL THOSANII HITEN DHIRAJLAL THOSANI

CHANGE OF NAME

Old Name from **BHADJA NISARG** RAKESH

to my New Name BHADJA NISARG

RAKESHBHAI 401, Shreeji Palace-B, Street No.19, Fulvatika Zanzarda Road, Junagadh - 362001

Changed My name as Pathan Gulammohami

0130059410-1

I,Krishna Kishor Badarshahi R/o.8 Navo kumbhar-vada, porban dar,Gujarat have changed my name to Dakshaben Kishorbhai Badarshahi for all futur

IN THE COURT OF CIVIL JUDGS (SEMIOR DIVISION) 1 CUM COMMERCIAL COURT, PATNA Commercial Dispute Case no. 16 of 2023 Marchad Rej Infratech Pvt. Ld Patna-800020, Birar ... Petitione Versus W/S Nekto Engineers and Projec Consultants ... Responden MOTICE

To, M/S Nektor Engineers and Project Consultants through Its Director- Mr. Shivang V Pethani having its office at B-104, Silicor Valley Complex, Near Shivranjan Cross Roads, Sate Illite Abmodeland, 38045 Ruisst

Valley Complex, Nead Shirvanjaln Almondand Shirvandan Almondand Shirvandan Sh

appear. Given under my hand and seal or this the 13 day of 11 2025. CIVIL JUDGE (SENIOR DIVISION)- 1 CUM COMMERCIAL COURT, PATNA

" IMPORTANT "

PUBLIC NOTICE OF SUMMONS PUBLIC NOTICE OF SUMMONS

arat, that summons have been Issued instruction Co. No. 451SUM/2023, filled Metal Care Alloys Pvt. Ltd., before the 15te Judicial Magistrate (First Class), nCourt, Esplanade, Mumbal.

are hereby Informed that, asper the redated 07807/2025, passed by the 15th Court, service of summons upon its directed to be made by way of incidition, since ordinary service could not infected.

scied.
dingly, you are required to appear
the Hon'ble Judicial Magistrate (First
), 64th Court, Esplanade, Mumbal, on
nuary, 2026, to answer the complaint

or case.

Ir notice that if you fall to appea
Court on the sald date, the matte
ed ex parte, and suitable order
ssed in accordance with law.

Igw.

By Order of the Court
Judicial Magistrate (First Class)
64th Court, Esplanade, Mumbai.



Accordingly, you are required to a before the Hon'ble Judicial Magistratic Class), 64th Court, Esplanade, Mum 13 January, 2026, to answer the conin the above case. Take further notice that if you fail to before the Court on the said date, th

shall proceed ex parte, and apporters shall be passed in accordal

atul



Atul Ltd

e: Atul House, G I Patel Marg, Ahmedabad 380 014, Gujarat, orate identity number: L99999GJ1975PLC002859 Telephone: (+91 79) 26461294 | 26463706

NOTICE
reby given that the SEBI vide pecial Window of six months i.e. f 06, 2026, transfer of shares from physical shares to demat mode when transfer request was lodged on or before April 01, 2019, but was neapproved and returned due to deficiencies and

ases falling in the above criteria may relodge transfer requests along uly executed requisite documents expeditiously with the MUFG In Idia Pvt Ltd, Registrar and Transfer Agent.

Twick, registrar and transfer Agent.

he Investor Education and Protection Fund Authority (EPFA) unched a 100 days Campaign, Saksham Niveshak. Under ampaign, shareholders are advised to updated their KYC and claim vidends that remain unclaimed or unpaid and are lying with the Comporter to avoid the transfer of such dividends and the underlying share the IEFFA, in accordance with the applicable provisions of omparies Act, 2013.

For Atul Ltd

Atul December 08, 2025

सीडैक 🍂 अंक्ट्स CDAC 🔏 OCts

Centre for Development of Advanced Computing (C-DAC)

Admission Announcement for

Post Graduate Certificate Courses in ICT domain for February 2026 Batch

C-DAC announces admission to the following 12 career-oriented full-time 24 weeks courses for Graduate in Engineering (selected streams) or Post Graduate in Science (selected discipline) or M.C.A. For common and course spe

with NCVET standards, C-DAC's 900-hour PG Diploma courses are upgraded to 1200-hour (24-week) Post Graduate Certificate mmes of 40 credits. NSQF alignment and NCVET approval are under

Post Graduate Certificate Programmes in ICT

Advanced Computing (PGCP-AC)

Big Data Analytics (PGCP-BDA) Embedded Systems Design (PGCP-ESD)

IT Infrastructure, Systems & Security (PGCP-ITISS)

Artificial Intelligence (PGCP-AI)

VLSI Design (PGCP-VLSI)

Mobile Computing (PGCP-MC) Advanced Secure Software Development (PGCP-ASSD)

HPC System Administration (PGCP-HPCSA)

Robotics and Allied Technologies (PGCP-RAT)

Fintech and Blockchain Development (PGCP-FBD)

Cyber Security and Forensics (PGCP-CSF)

National Common Campus Placement Programme (NCCPP) organised at E Hyderabad, Mumbai, Noida and Pu

Last date of Online Application

DECEMBER 29, 2025

C-DAC Common Admission Test

C-CAT I: JANUARY 10, 2026 C-CAT II: JANUARY 11, 2026

Course Commencer

FEBRUARY 25, 2026

ses offered at: • Bengaluru • Bhubaneswar • Chennai • Guwahati • Hyderabad • Indore • Kochi • Kolkata • Karad • Mumbai • Nagpur • Nashik • New Delhi • Noida • Patna • Pune • Thiruvananthapuram

ses, Syllabus, C-CAT, Eligibility, Regi

9373731598/ +9120 25503134 www.facebook.com/OfficiallyACTS www.cdac.in; acts.cdac.in www.facebook.com/OfficiallyACTS



CHANGE OF NAME SANGITA HITENBHA THOSANI DECLARE summoning for OFC replacem omson road - PHQ-NDRB-Vayu awan-Executive Enclave (CV) BBH - Thomson road section of intenance of OFC for 5 years. To der document are availed. NAME FROM SANGITA HITENKUMAR THOSANI TO SANGITA HITENBHAI THOSANI

AND FROM NOW ONWARDS I SHALL BE KNOWN BY NEW NAME AS SANGITA HITENBHAI THOSANI SANGITA HITENBHAI THOSA

I, GEETA W/o No 2684784A
EX-NK MAHEDU JAYESH
BHAI KARNIDAN BHAI,
Residing at A-203 Pramukh
Horizon-1, Sargasan,
Gandhinagar-382421 have
changed my Name from
GEETA io MAHEDU
GITABEN DOB 11/05/1973
Before Class - I Magistrate 0050279596-1

,Kishor Naran Badarsi R/o.8 Navo kumbhar-v R/o.8 Navo kumpnar-var porbandar,Gujarat have changed my name to Kishorbhai Naranbhai Badarshahi for all future

0130059411-1

POULTRY STERILIZED HATCHERY

FEED/FARMING

to 20 %

RAILTEL





CANCELLATION NOTICE

ADANI WIND ENERGY KUTCHH THREE LIMITED

CIN No: U40300GJ2019PLC106778

PUBLIC NOTICE

Adani Wind Energy Kutchh Three Limited having its registered office at Adani Corporate House, Shantigram, Nr. Vaishno Devi Circle, S G Highway, Khodiyar, Ahmedabad – 382 421, Gujarat, India Intends to apply to the Government of India to confire upon him all the powers under section 164 of the Electricity Act, 2003 for the placing of electric lines or electric plant for the transmission of electricity or for the purpose of relephonic relegraphic communications necessary for the proper coordination of works which telegraph authority possess under the Indian Telegraph Act 1885 with respect to the placing of telegraph lices and posts for the purpose of a telegraph established or maintained, by the Government or to be so established or maintained and will undertake the survey, construction, installation, inspection, erection and other works to be followed by commission Scheme: 'Interior Connectivity to Adani Wind Energy Kutchh Three Limited Transmission Scheme: 'Interior Connectivity to Adani Wind Energy Kutchh Three Limited

Transmission Scheme: "Interim Connectivity to Adani Wind Energy Kutchh Three Limited for its 300 MW Wind Power Project in Kachchh, Gujarat.

Scope of Work: 400 kV D/c line from AWE/SI, PSS (Generation switchyard situated in village Beraja, Taluka Mundra, district Kachchh, Gujara) to LILO Point (Situated in village Deshalpar, Taluka Mundra, District Kachchh) of GOEU-Jetpur 400 kV D/c line. (The Total line Length is approx. 7 Km, which would be implemented on D/c towers)

The transmission line covered under the scheme will pass through, over around and

between the following villages, towns, and cities in the state of Gujarat.

District: Kachchh. Tehsil: Mundra.

Name of Village: Babia, Tumbadi Moti, Tumbadi Nani, Ramania, Beraja, Bocha, Gelada, Karaghogha, Depa, Nani Khakhar, Moti Khakhar, Desalpar,

District: Kachchh. Tehsil: Mandavi. Name of Village: Faradi.

Copy of the route alignment is available in the office of the undersigned. Notice is hereby given to the general public to make observation / representation on the proposed transmission system within 60 days of publication of this notice to the office of the undersigned in writing.

For further particulars and clarifications please contact:

Name: Diwakar Kumar | Designation: Authorised Signatory Office: Adani Corporate House, Shantigram, Nr. Vaishno Devi Circle, S. G. Highway Khodiyar. Ahmedabad – 382 421.

Email Address: diwakar.kumar@adani.com | Phone no: 079 255 58439

NAVINAL TRANSMISSION LIMITED

C 105, Anand Niketan, New Delhi 11002

(Under sub-section (2) of Section 15 of the Electricity Act, 2003)

NAVINAL TRANSMISSION LIMITED. having its Registered Office at C 105, Anand Niketan, New Delhi, 110021, which is incorporated under the Companies Act, 1956, has made an application for Grant of Separate license under section 14 b 15 of the Electricity Act, 2003 and Central Electricity Regulatory Commission (Procedure, Terms and Conditions for grant of Transmission License and other related matters) Regulations, 2024 in respect of approval of Central Transmission Utility for implementation of following transmission on scheme through regulated tarff mechanism.

Sr. No.	Name of the Transmission Element	Estimated Completion Cost or Levelised Transmission Charges	Completion Target	Remarks
1.	Transmission system for providing connectivity to RE applicant(s) at Navinal (Mundra)(GIS)	Rs. 105.09 Cr - mentioned as estimated cost by CTU Office Memorandum dated 04.08.2025	24 months from issuance of OM by CTUIL.	

and other documents filed before the Commission complete approaching the control of the control of

Objections or suggestions, if any, be filed before the Secretary, Central Electricity Regulatory Commission, **6"**, **7"** & **8"** Floors, Tower B, World Trade Centre, Nauroji Nagar, Mou Delhi-110029, with a copy of the objection(S) suggestion(S) to the applicant or its authorized agent, within 45 days of the publication of the notice in the newspaper.

adani

Adani Green Energy Limited NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING

NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING

NOTICE is hereby given that the Extra Ordinary General Meeting (EGM) of Members of Adani Green Energy Limited will be held on Friday, January 02, 2026 at 11.00 am. through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAWM"), to transact the business set out in the notice for the EGM ("Notice of EGM") in compliance with applicable provisions of the Companies Act, 2013 read with rules issued thereunder, and General Circulars issued by Ministry of Corporate Afriair from time to time and Circulars issued by the Securities Exchange Board of India, without the personal presence of the members at the meeting, to transact the business, as set out in the Notice convening EGM circulated for convening the EGM.

The Chemistry to the Bold.

The Company has sent to Notice convening EGM on December 08, 2025 through electronic mode to the Members whose email addresses are registered with the Company and/or Depositories in accordance with the MCA Circulars and SEBI Circulars. The requirement of sending physical copies have been dispensed with violet he MCA Circulars and SEBI Circulars. Notice convening EGM is also available on the website of the Company at www.adaningreenenergy.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.woiting.nsdl.com.

Persuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Repulation 44 of the Recurities and Exchange Board of Inside (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members are provided with the facility to cast their covision and instruction of the Company and the Company of the Company of the Company and the Company of the Company of the Company of the Company of Company and Company as on December 26, 2025 (Company as on December 26, 2025) (Company as on December 26, 2025) (Company as on December 26) (David Company) and consequence of the Company).

In case Member(s) have not registered their e-mail addresses with the Company, Depository, please follow the below instructions to register e-mail address for obtaining login details for e-voting

- gin details for e-voting.

 For members holding shares in Physical mode please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of FAN card), AADHAR (self-attested scanned copy of

Members holding shares in either physical form or in dematerialized form as on the Cut off date, may cast their vote electronically on the special business matters set out in the Notice through remote e-voting of NSDL. Members are informed that:

- a. All the special business matters set out in the Notice will be transacted through voting by electronic means only
- b. The remote e-voting shall commence on Monday, December 29, 2025 at 9.00 a.m. IST
- The remote e-voting shall commence on Monday, December 29, 2023 at 9, 00 a.m. IS1. The remote e-voting shall end on Thursday, January 01, 2026 at 5, 00 p.m. IST. Any person who becomes a member of the Company after the date of sending the notice of this EGM and holding shares as on the out-off date, may obtain the login ID and password by sending a request to evoting@nsdl.co.in or investor.agel@adani.com. However, if the person is already registered with NSDL for remote e-voting, then the existing login ID and password may be used to east the vote.
- Members will not be able to cast their vote electronically beyond the date and time mentioned above and the remote e-voting module shall be disabled for voting by NSDL
- thereafter.

 f. Once the vote on a resolution is cast by the member, he/she shall not be allowed to cathenge it subsequently or cast the vote again.

 g. Members who have voted through remote e-voting will be eligible to attend the EGM. However, they will not be eligible to vote at the EGM.

 Norly those Members, who will be present in the EGM through VC/OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system in the EGM.

the EGM. In case you have any queries or issues regarding e-voting, you may refer to the Frequently Asked Questions (FAQS') and e-voting manual available at www.evoting.nsdl.com, under help section or write an email to evoting@msdl.co.in or call toll free number 1800/222-990. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Ms. Sarita Mote. Assistant Manager, National Securities Depository Limited. Trade World. 'X Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai. 400013 at the designated email address saritam@nsdl.co.in or call on 022-24994890.

uzz-z4y949y0. The details of EGM are available on the website of the Company at <u>www.adanigreenenergy.com</u>, NSDL at <u>www.evoting.nsdl.com</u>, BSE Limited at <u>www.bseindia.com</u> and National Stock Exchange of India Limited at <u>www.nseindia.com</u>.

For, Adani Green Energy Limited Pragnesh Darji Company Secretary

Registered Office: "Adani Corporate House", Shantigram, Nr. Vaishno Devi Circle, S. G. Highway, Khodiyar, Ahmedabad - 382421, Gujarat, India Phone Nu. +91-92-656 5555 | Fax No. +917-9255 5550 Website: www.adanigreenenergy.com | CIN: L40106GJ2015PLC082007



The Indian EXPRESS

get the inside information and get inside the information.

the Indian Intelligent. Indian Express.

1

anlon NOTICE FOR THE ATTENTION OF THE MEMBERS OF THE COMPANY

Description of Special Resolutions

To consider and approve the variation in one of the objects of the initial public offering (IPO) for proposed expansion through inorganic growth and further upgradation

allot by remote excitor,
and copies of rocking, postal ballot form and prepaid business reply envelope have not been sent to the
to communicate their assent or diseased ruly through the remote e-volting system. The Company has en
providing render exciting facility from heterorized postal provider grantee evention
and the sent of the remove of the remove of the removal provider grantee events and the removal provider grantee events are sent to the
life as validate during the following period:

| Truesday | December 109, 2025, 19:400.

remote e-voting Tuesday, December 09, 2025, 09:00 A.M. (IST) ting Wednesday, January 07, 2026, 05:00 P.M. (IST)

said date and time and the remote e-voting module shall be forthw slution is cast by a member, no change will be allowed subsequently.

Members hading been in played mode, who have not registered fundated their e-mail address with the Physical holding Physical

Participant, a measurement are reposited for register (update their e-mail address with the Depository
Participant (and where they maintain their demail accounts).

The Company has appointed Min. R. P. Greiseria and Associatios, Practicing Company Secretary (2P No. 1948) is set as the Southeries. The Company has appointed Min. R. P. Greiseria and Associatios, Practicing Company Secretary (2P No. 1948) is set as the Southeries. The Restate decidence along with the Southeries company and their set and the Southeries and Southe

adani

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ

એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ<u>ની નોટિસ</u>

આથી નોટિસ આપવામાં આવે છે કે અદાણી ત્રીન એન્જી લિમિટેકના સભ્યોની એક્ટ્રા ઓર્કિનરી જનરવ મીટિંગ (છજીએમા શુક્રવાર, ૦ટ જન્મુઆરી, 2026 ના રોજ સવારે 11.00 વાગ્યે વીડિયો કોન્ફરન્સ ('વીસી') / અન્ય ઓડિયો વિરુધુઅવ મીન્સ ('ઓએવીએમ') દ્વારા યોજાશે, જેથી કંપની એક્ટની વાગુ જોગવાઈઓનું પાવન કરીને છજીએમ ('ઇજીએમની નોટિસ') માટે ુ જાન્યું માનન જ દ્વારા ના સાથ્યું કરાયા કરવા કરવા કરવા કરવા હતું. હતું કરવા કરવા છે હતું કરવામાં ના ત્યારે કર મીટિયમાં નિર્ધારિત વ્યવસાયને વ્યવહાર કરી શકાય. વર્ષ 2013માં નિયમો અને કોપીરેટ બાબતોનાં મંત્રાવય દ્વારા સમયાંતર જાહેર કરવામાં આવતા સામાન્ય પરિપત્રો અને સિક્યોરિટીઝ એક્સપેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા દશ્યુ કરવામાં આવેલા પરિપત્રો સાથે વાંચવામાં આવે છે, જેમાં બેઠકમાં સભ્યોની વ્યક્તિગત હાજરી વિના વ્યવસાયની કામગીરી હાથ પરવામાં આવે છે, જે ઇજીએમ બોલાવવા માટે વહેંચવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યં છે.

કંપનીએ 08 ડિસેમ્બર, 2025ના રોજ ઇવેક્ટ્રોનિક મોડ દ્વારા ઇજીએમ બોલાવવાની નોટિસ એમસીએ પરિપત્રો અને સેબી કરવામાં આ ઇતાલમાર, 2021 દાર કરાકડુલાંગ કહ્યું છે. કહ્યું તે કહ્યું વધાના વધાના મારા ત્યાર પાય માને પારિયા સમાચ પિપાસો અનુસાર કંપની અને,ભ્યવાલ ડિપોડિસ્ટીઝ સાથે નોધાયેલ સભ્યોને મોકાલી છે. ભીતિક નકવો મોકાવલાની જન્દરિયાત MCA પરિપાસે અને SEBI પરિપાસી દ્વારા દૂર કરવામાં આવી છે. છજીએમ બોલાવવાની નીટિસ કંપનીની વેબસાઇટ પર www.adanigreenenergy.com અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોડિસ્ટી લિપિટેડ (બેનએસડીએલ)ની વેબસાઇટ પર w.evoting.nsdl.com પર પણ ઉપવબ્ધ છે.

કાયદાની કવમ . 108 અને કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, 2014ના નિયમ 20ની જોગવાઇઓ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સયેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (શિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ કિસ્લોઝર રિકવાયરમેન્ટ્સ) રેપ્યુલેશન્સ, 2015ના નિયમન 44ના અનુસંધાનમાં, સભ્યોને એનએસડીએલ દ્વારા પૂરી પાડવામાં આવતી છલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ રહાના માના વિશ્વસાના કરવાના કરવાના સાથે કરવાના સ્વારાય કરવાના સાથે કરવાના સાથે કરવાની સુધીયા પૂરી પાડવામાં હું બન્દીરિમુનો ઉપયોગ કરીને છજીએમાંની નીટિસમાં જણાવ્યા મુજબ તમામ કરાવો પાર મહાના કરવાની સુધીયા પૂરી પાડવામાં આવે છે. સમ્યોના મતદાનના અધિકારો ટર્ક ડિસેમ્બર, 2025 (કરે-ઓફ કેટ') ના રોજ કંપનીના પેઇક-અપ ઇક્વિટી શેર કેપિટથમાં તેમના દ્વારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે.

જો સભ્ય(ઓ) એ કંપની/ડિપોઝિટરી સાથે તેમના ઇ-મેઇલ સરનામાંની નોંધણી કરાવી ન હોય, તો કૃપા કરીને ઇ-વોર્ટિંગ માટે લોઝિન વિગતો મેળવવા માટે ઇ-મેઇલ સરનામું નોંધાવવા માટે નીયેની સૂચનાઓનું પાલન કરો.

- ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો માટે કૃપા કરીને ફોલિયો નંબર, શેરહોલ્ડરનું નામ, શેર સર્ટિફિકેટની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ), પાન (પાન કાર્ડની સ્વ-પ્રમાણિત રકેન કરેલી નકલ), આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત રકેન કરેલી નકલ) જેવી જરુરી વિગતો investor.agel@adani.com પર ઇ-મેઇલ દ્વારા પ્રદાન કરો.
- ડીમેટ મોડમાં શેર ધરાવતા સભ્યો તેમના સંબંધિત ડિપોઝિટરી સહભાગીનો સંપર્ક કરીને અથવા. ડીપીઆઈડી-સીએલઆઈડી ાં તે એકના ડીપીઓઇડી + સીએલઆઇડી અથવા 16 એકના લાભાર્થી આઇડી), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા કોન્સોલિટેડે. એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ, પાન (પાન કાર્ડની સ્વ.પ્રમાણિત સ્કેન કરેલી નકલ), આયાર (આયાર કાર્ડની સ્વ.પ્રમાણિત સ્કેન કરેવી નકવ) ની વિગતો સાથે investor.agel@adani.com પર ઇ-મેઇવ દ્વારા નોંધણી કરાવી શકે છે.

કટ-ઑક તારીખ મજબ ભૌતિક સ્વરૂપમાં અથવા ડિમટિરિયલાઇઝડ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો એનએસડીએલના રિમોટ ઇ-વોર્ટિંગ દ્વારા નોટિસમાં નિર્ધારિત વિશેષ વ્યવસાયિક બાબતો પર ઇવેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શકે છે. સભ્યોને જાણ કરવામાં આવે છે કે

- નોટિસમાં નિર્ધારિત તમામ વિશેષ વ્યવસાયિક બાબતોનો વ્યવહાર માત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાન દ્વારા કરવામાં આવશે.
- રિમોટ ઈ-વોટિંગ સોમવાર, 29 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 9.00 વાગ્યે IST શરુ થશે
- રિમોટ ઇ-વોટિંગ ગુરુવાર, 01 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે 5.00 વાગ્યે IST સમાસ થશે.
- કોઈ પણ વ્યક્તિ કે જે આ ઇજાએમની નોટિસ મોકલવાની તારીખ પછી કંપનીના સભ્ય બને છે અને કટ-ઓફ તારીખે શેર પરાવે છે, તે evoting@nsdl.co.in અથવા investoragel@adani.com પર વિનંતી મોકલીને લીગિન આઇડી અને પાસવર્ડ મેળવી શકે છે. જો કે, જો વ્યક્તિ પહેલાથી જ રિમોટ ઇ-વોટિંગ માટે એનએસડીએલમાં નોંધાયેલ છે, તો મતદાન કરવા માટે હાલના લોગિન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકાય છે.
- સભ્યો ઉપરોક્ત તારીખ અને સમય પછી ઇલેક્ટ્રોનિક રીતે મતદાન કરી શકશે નહીં અને ત્યારબાદ એનએસડીએલ દ્વારા મતદાન માટે રિમોટ ઇ-વોટિંગ મોડ્યુલને નિષ્ક્રિય કરવામાં આવશે
- એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મતદાન કરવામાં આવે પછી, તેને/તેણીને પછીથી તેમાં ફેરફાર કરવાની અથવા ફરીથી મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
- મતદાન કરવા માટે પાત્ર રહેશે નહીં.
- માત્ર એવા સલ્યો કે જેઓ VC/ OAVM સુવિધા દ્વારા EGM માં હાજર રહેશે અને રિમોટ ઇ-વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાનો મતદાન કર્યો નથી અને અન્યથા તેમને આમ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, તેઓ EGMમાં ઇ-વોટિંગ સિસ્ટમ દ્વારા મતદાન કરવા માટે પાત્ર રહેશે.

ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો ("FAQs") અને ઇ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો છો અથવા evoting@nsdl.co.in પર

ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા મતદાન માટેની સુવિધા સાથે જોડાયેલી તમામ ફરિયાદો સુશ્રી સરિતા મોટે, આસિસ્ટન્ટ મેનેજર, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, ટેડ વર્લ્ડ, 'એ' વિંગ, યોથા માળે, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઇ - 400013 પર નિયુક્ત ઈમેઈલ સરનામાં saritam@nsdl.co.in પર સંબોધિત કરી શકાય છે અથવ

ઇજીએમની વિગતો કંપનીની વેબસાઇટ www.adanigreenenergy.com, એનએસડીએવની www.evoting.nsdl.com બીએસઈ વિમિટેડ www.bseindia.com અને નેશનવ સ્ટોક એક્સયેન્જ ઓફ ઇન્ડિયા વિમિટેડ www.nseindia.com પ

રજસ્ટર્ડ ઓકિસ: "અદાણી કોર્પોરેટ હાઉસ". શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે. એસ. જા. હાઇવે. ખોડિયાર. ામદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત. **! કોન:** +૯૧-૭૯-૨૬૫૬ ૫૫૫૫ **! કેકસ:** +૯૧-૭૯-૨૫૫૫ ૫૫૦૦ www.adanigreenenergy.com | สโฟเฮฟิศ: L40106GJ2015PLC08200

જે સભ્યોએ રિમોટ ઇ-વોટિંગ દ્વારા મતદાન કર્યું છે તેઓ ઇજીએમમાં ભાગ લેવા માટે પાત્ર બનશે. જો કે, તેઓ ઇજીએમમાં

જો તમને ઇ-વોટિંગ સંબંધિત કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય. તો તમે મદદ વિભાગ હેઠળ www.evoting.nsdl.com પર ઇમેઇલ લખી શકો છો અથવા ટોલ ફ્રી નંબર 1800-222-990 પર કૉલ કરી શકો છો.

022-24994890 પર કૉવ કરી શકાય છે.

પ્રજ્ઞેશ દરજી તારીખ: ડિસેમ્બર 08, 2025 કંપની સેક્રેટરી

Date : December 08, 2025 Place : Kolkata

Sd/-Company Secretary and Compliance Officer

Further, since the e-uoing of the EGM has already been commensed from December 6g, 8026, those shareholders who have voted with regard to the above resolution may give his/her orpinion/remark through mails to the Company Registers and Share Transfer Agent vits. All/EGI nitrine indial Private Limited at the mail id-enotices@in.mpms.mufg.com or to the Company at the mail id-esc@ganshinkra.com on or before the EGM scheduled to be held on Wednesday, December 10, 2025 at 4.00 p.m.

2025 at 4.00 p.m.
On and from the date hereof, the EGM Notice dated November 17, 2025, earlier Corrigendum Notice published on Friday 28th November, 2025 in Financial Express (English Newspaper) and Second Corrigendum Notice published no Wednesday 37d December, 2025 in Financial Express (English Newspaper) and Exdin (Bengail Newspaper) shall always be read in conjunction with this Corrigendum which is also being uploaded on the website of the Company at www.ganeelsinfar.com, on the website of the Company at www.ganeelsinfar.com, on the website of the Company are instead on the website of the Company are instead on the website of the Company are instead to the Company are instead by this Corrigendum, shall remain unchanged.

Ry Order of the Repart of Illirectors

By Order of the Board of Directors For Ganesh Infraworld Limited

જારા લાઇકાર તે પહોંચ તે 'એ-ન્યા, જામે આતા, તેમાં એ એટલાબર્ડિક, હરેલા દિલ્લેમ સાથે, જામનારા, ગુજરાત-મૃષ્ણભ્ય ભાર કુલાય લાદ, કમેશ્વર ભારત (ત્રિ.સ.) જરાતાર મિલાકોનો ત્રિલાકોના તેમારા માટે દેવાલા નીટાસ દિલ્લોકોનો અને કુલાય કે તેમાં કુલાય કે તેમાં કુલાય કે ત્રિલાકોનો ત્રિલાકોનો હતી કરેલા કર્યો કરેલા કર્યો કરેલા દિલ્લોકોનો અને કર્યો કરેલા કર

બજાજ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

FINSERV

ઇ-હરાજીની લિગતો ઇ-હરાજીની તારીખ: ૨૬-૧૨-૨૦૨૫ સતારે ૧૧:૦૦ ચી ૧ ૦૦ વાગ્યા દરમિયાન ૫ મિનિટના અમર્યાદિત લંબાણ સત્ ૨) ઇએમડી તેમજ કેવાસસી ૧મા કરવાની છેલી તારીખ:

📭 HDB::::::: એચડીબી ફાયનાન્સિયલ સર્વિસીઝ લીમીટેડ

on to bushi famil of BEC Birk **રજીન્ટર કે ઓફીસ**ા સાદિકા, બીજો માળ, લૉ ગાર્ડન રોડ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત, પીનકોડ **સામ્યા ઓફીસ**ા ૧૦૧, પહેલો માળ, વુસભાકૃતિ કોપરયેલ વિલ્લીંગ, તેરસ્સાઇક સોપ સામે, સ્થામલ કોસ રોડ પાસે, અમદાવાદ-૩૯ **ા ઓફીસ**ા ભીજો માળ, શ્રી કેલાશ સાગર પલાઝા, દિલાયન્સ ફેન્ડ્રેઝ ઉપર, સીમંદાર પૈન મંદિર પાસે, મોઢેરા કોસ રોડ લાળે, મહેસા

પામના અને ફોર્મ માં ખીતું માત, તો દેવતા સામ વ્યવસ્થા માત્ર માત્ર તા હતા. માત્ર માત્ર તા હતા. માત્ર માત્ર તા હતા. માત્ર માત્ર માત્ર તા હતા. માત્ર માત્ર તા હતા. માત્ર માત્ર તા હતા. માત્ર માત્ર માત્ર હતા. માત્ર માત્ર માત્ર માત્ર હતા. માત્ર મા

ત. કોઇપણ વિરોધ અને સમાધાન માટે સંપર્ક: શ્રી સમકરણ મીશ્રા નં. હદુ ૧૧૬૦૦૯ (એસ્થિક લેક્શન મનેજર), શ્રી પ્રશાંત સંપર્ક નં. હદ્૧૦૮૦૦૯૦ (ઝોનલ કલેક્શન મેનેજર) એસડીની ફાચનાબ્સિયલ સર્વિસીઝ લીમીટેડ.

તારીખ : ૦૯/૧૨/૨૦૨૫

એચડીબી ફાયનાન્સિયલ સર્વિસિઝ લીમીટેડ વતી

GANESH INFRAWORLD LIMITED

GANESH INFKAWORLD LIMITED

CIDI - Le6620W80294PLC268366

Red. Office : Godrej Genesis, Julii No. 906, HF Isoro, Street No. 18, Block - EP & GR Sector - V, Salt Lake, North 24 Parganas, Kolkata - 700091; Telephone : (033) - 4604 1066

Email: ce@ganeshinfra.com; Website : www.ganeshinfra.com

CORRIGENDUM TO THE NOTICE OF EXTRA ORDINARY GENERAL MEETING OF THE MEMBERS OF GANESH INFRAWORLD LIMITED TO BE HELD ON WEDNESDAY, DECEMBER 10, 2025

OF THE MEMBERS OF GANESH INFRAWORLD LIMITED TO BE HELD ON WEDNESDAY, DECEMBER 10, 2025

We draw the attention of all the Members of Ganesh Infraworld Limited (the Company') to the Notice dated November 17, 2025 for convening the Extra Ordinary General Meeting of the Company (EGMY) scheduled on Wednesday, December 10, 2025 at 4.00 pm. through Video Conferencing (VCD) / Other Audio-Visual Means (YOAWH). The EGM Notice has already been dispatched/ emailed to all the members of the Company on November 18, 2025 in due compliance with the provisions of the Company as event of the Company of the Standard ordinary and the Standard ordinary for the Standard ordinary and the Standard ordinary for the Standard ordinary fo

Identity of the natural persons who are the ultimate beneficial owners of the Equity Shares proposed to be allotted and/or who ultimately control the proposed allottees"

he following are the disclosures of Ultimate Beneficial Ownership of the proposed allottees as

applicable:									
I	SI. No.	Name of the Allottees	Category	Beneficial Ownership					
	- 1	Stentrade Revolution Fund II	Non-Promoter	1 Kraeha Kailaeh Gunta					

II. On page 1, 2, 8 & 9

sed to be allotted to certain identified non-promoter per The Equity Shares are pro The Company has decided to issue equity shares to only 35 shareholders and shall not issue equity shares to the following shareholders whose names are given in the resolution No. 1:

"ISSUE OF SECURITIES ON A PREFERENTIAL BASIS TO MEMBERS OF THE COMPANY" read with the Explanatory statement given in Page 8 & 9 due to non-submission of required documents to the

Compa	Company for the issuance procedure.							
SI. No.	Name of the Proposed Allottee	Category	No. of Equity Shares	Total Equity INR				
1	Shweta Sethi	Non-Promoter	86400	2,01,31,200				
2	Vinayak Rajendra Agarwal	Non-Promoter	21600	50,32,800				
10	Sourabh Kasliwal	Non-Promoter	10400	24,23,200				
36	Plantify Venture LLP-Venture X Fund I	Non-Promoter	86400	2,01,31,200				
39	Girijadhava Vyapaar Private Limited	Non-Promoter	43200	1,00,65,600				